



સ્વચ્છ
સર્વેક્ષણ
લીગ 2020

રાજકોટ મહાનગરપાલિકા

ટાઉન પ્લાનીંગ શાખા,

મહાનગર સેવા સદન, રૂમ નં. ૮, ત્રીજો માળ,

"ડો. આંબેડકર ભવન", ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧

www.rmc.gov.in

રા.મ્યુ.કો./ટી.પી./સે.ઝોન/ખ.નં. :- ૬૩૦

તા. ૨૩/૮/૨૦૨૧

પ્રતિ-

શ્રીમતી રૂબી પાર્થિવર
શ્રીમતી કલ્પા રામભાઈ પટેલ
રાજકોટ

વિષય : ઝોનિંગ સર્ટીફિકેટ આપવા અંગે.

સત્તામંડળ (૩૬૧) ની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ અન્વયે.

સંદર્ભ : આપશ્રીની તા. ૨૩/૮/૨૦૨૧ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષયે આપશ્રીની અરજીમાં નિર્દિષ્ટ વિસ્તાર સાથે સામેલ નકશા મુજબ મોજે- ધરેશ્વર તાલુકો -
રાજકોટના રેવન્યુ સર્વે નં. - ૮૬ અંતિમ ખંડ નં. - — પ્લોટ નં. - ની જમીન ગુજરાત નગર રચના અને
શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૭ (૧)(સી) અન્વયેના સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી
ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા નં. - જીએચ/વી/૧૯૨ ઓફ ૨૦૧૬/ડીવીપી-૧૩૨૦૧૬-૨૨૩૭૦૨-
એલ, તા. ૨૭-૧૦-૨૦૧૬ થી મંજૂર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ ની
અમલી દરખાસ્તો મુજબ રહેઠાણ મોજ માં સૂચિત કરાયેલ છે.
જે.સ.પે. નં. મ. ૩૦૨-૫૫૭ જે. ૨૪-૦૦ મી. પાવેડ ડી.પી. ૨૦
૫૨૫૨ આપ છે.

સદરજી જમીન મોજે- ધરેશ્વર ની ટી.પી. સ્કીમ નં- ૩૬૧૩ના હદ વિસ્તારમાં આવતી હોય હોવાથી
તેને ટી.પી. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો/જોગવાઈઓ લાગુ પડશે અને ફેરફારને પાત્ર રહેશે

ખાસ નોંધ :-

આ ફક્ત ઝોનિંગ સર્ટીફિકેટ છે. વિકાસ/ખાંધકામ પરવાનગી નથી.

Hec
આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર
રાજકોટ મહાનગરપાલિકા



RAJKOT MUNICIPAL CORPORATION

TOWN PLANNING DEPARTMENT

DR.AMBEDKAR BHAVAN,DHEBAR ROAD,RAJKOT.

PART PLAN


OF

SECOND REVISED DEVELOPMENT PLAN 2031 A.D.

(Sanctioned under sec 17(1)(c) of the Gujarat Town Planning & Urban Development Act .1976

Vide U.D. & U.H. Department Notification No.GH/V/192 of 2016/DVP-13-2016-223702-L,Dated 27-10-2016.

Sanctioned Variation in the Second Revised Development plan of RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY (RUDA)
under Government Notification of Urban Development & Urban Housing Department No.GH/V/276 of 2017/DVP-132017-725-L,
Dated 13-10-2017. & It's Corrigendum No.GH/V/296 of 2017/DVP-132017-725-L,Dated 24-10-2017



In case of Any Errors/Disputes The Record At Ruda Office Shall Be Considered Official & Shall Be Final & Binding to All.
NOTE :. This part plan can not be used for making any entry in revenue records and can not
be considered as Development Permission for Addition/Alteration.

ISSUED ONLY FOR

SURVEY NO: 96

VILLAGE: GHANTESHWAR

TALUKA: RAJKOT



Scale : 1Cm. = 80 Mt.

LEGEND :

Residential Zone

Proposed Road

Prepared By : *[Signature]*

Checked By : *[Signature]*

Date : 23/9/21

TRUE COPY

[Signature]
ASS. TOWN PLANNER
RAJKOT MUNICIPAL CORPORATION
RAJKOT